



JBE-002-2021002

Seat No. _____

M. Com. (Sem. I) Examination

December - 2019

Economics

(Managerial Economics)

(New Course)

Faculty Code : 002

Subject Code : 2021002

Time : $2\frac{1}{2}$ Hours]

[Total Marks : 70

સૂચના : (૧) મુદ્દાસર જવાબ આપો.

(૨) દરેક પ્રશ્નના ગુણ જમણી બાજુ દર્શાવેલ છે.

૧ (અ) સંચાલકીય અર્થશાસ્ત્ર એટલે શું ? તેનું સ્વરૂપ સમજાવો. ૧૦

(બ) સંચાલકીય અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર સમજાવો. ૧૦

અથવા

૧ વૃદ્ધિ અને વટાવનો સિદ્ધાંત ઉદાહરણસહિત સમજાવો. ૨૦

૨ (અ) માંગની મૂલ્યસાપેક્ષતા એટલે શું ? તેના પ્રકારો સમજાવો. ૧૦

(બ) માંગનો નિયમ સમજાવો. ૧૦

અથવા

૨ માંગની આગાહી એટલે શું ? સ્થાપિત વસ્તુની માંગની આગાહીની કોઈ પણ ચાર રીતો સમજાવો. ૨૦

૩ ઉત્પાદન વિધેયનો ખ્યાલ સમજાવો. પરિવર્તનશીલ ઉત્પાદન પ્રમાણનો નિયમ આકૃતિ સહિત સમજાવો. ૧૫

અથવા

૩ (અ) સંચાલકીય નિર્ણયો સાથે સંબંધિત એવા ખર્ચના ખ્યાલો સમજાવો. ૮

(બ) સમ-ઉત્પાદન રેખા એટલે શું ? સમ-ઉત્પાદન રેખાના લક્ષણો સમજાવો. ૭

૪ અલ્પહસ્તક ઈજારા હેઠળ ખાંચાવાળી માંગ રેખાનો સિદ્ધાંત સમજાવો. ૧૫

અથવા

૪ (અ) ખર્ચવત્તાની કિંમત નીતિ સમજાવો. ૮

(બ) કિંમત ભેદભાવ સમજાવો. ૭

ENGLISH VERSION

- Instructions :** (1) Write to the point.
(2) Mark of each question is indicated on the right side.

- 1 (a) What is Managerial Economics ? Explain its nature. 10
(b) Explain the scope of Managerial Economics. 10

OR

- 1 Explain with the example of incremental and discounting principle. 20
- 2 (a) What is price elasticity of demand ? Explain its types. 10
(b) Explain the Law of demand. 10

OR

- 2 What is demand forecasting ? Explain any four methods of demand forecasting for established goods. 20
- 3 Explain the concept of production function. Explain the Law of variable proportion with diagram. 15

OR

- 3 (a) Explain the concept of cost with related to managerial decisions. 8
(b) What is Iso-quant curve ? Explain the characteristics of Iso-quant curve. 7
- 4 Explain the principles of kinked demand curve under the oligopoly. 15

OR

- 4 (a) Explain the cost plus pricing. 8
(b) Explain the price discrimination. 7